

647510**MA02EcoC0510****Seat No: _____****M.A. (ECONOMICS) Semester - 2(CBCS) Examination****March/April- 2018****MACRO ECONOMICS-2****(CORE-2 (V))****Time: 2:30 Hours****Marks: 70****Instructions:**

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

પ્રશ્ન-૧ ઉપભોગવિધેયનો ખ્યાલ સમજાવો. કેઇન્સનાં મનોવૈજ્ઞાનિક ઉપભોગવિધેયનાં સિદ્ધાંતનું ટીકાત્મક (૧૪) મૂલ્યાંકનકરો.

અથવા

પ્રશ્ન-૧ ડ્યુએનબરીના ઉપભોગવિધેયની વિસ્તૃત ચર્ચા કરો. તેનો કેઇન્સનાં સિદ્ધાંત સાથેનો તફાવત સમજાવો.

પ્રશ્ન-૨ IS-LM રેખાઓની મુખ્ય લાક્ષણિકતાઓ જણાવો. IS-LM રેખાનાં મોડેલ દ્વારા સરકારની નાણાંકીય અને (૧૪) રાજકોષીય નીતિની સમજૂતી આપી, તેની અસરકારકતા તપાસો.

અથવા

પ્રશ્ન-૨ કેઇન્સનાં રોકડ પસંદગીનાં સિદ્ધાંતની ટીકાત્મક ચર્ચા કરો.

પ્રશ્ન-૩ કુગાવો એટલે શું? માંગ પ્રેરિત અને ખર્ચ પ્રેરિત કુગાવાનાં ખ્યાલો આકૃતિ સહિત સમજાવો. (૧૪)

અથવા

પ્રશ્ન-૩ કુગાવો અને બેરોજગારી વચ્ચેનો સંબંધ તાર્કિક અપેક્ષાઓનાં સિદ્ધાંતનાં સંદર્ભમાં વિસ્તૃત સમજાવો.

પ્રશ્ન-૪ નિશ્ચિત અને પરિવર્તન વિનિમય દરનાં સંદર્ભે ફ્લેમિંગ-મુંડેલ મોડેલની વિસ્તૃત ચર્ચા કરો. (૧૪)

અથવા

પ્રશ્ન-૪ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો નવ શિષ્ટ અર્થશાસ્ત્રીઓનાં ખ્યાલની ટીકાત્મક ચર્ચા કરો. (૧૪)

પ્રશ્ન-૫ ટૂંકનોંધ લખો. (ગમે તે બે) (૧૪)

(૧) કાયમી આવકનો ખ્યાલ. (૨) તરલતા પિંજર.

(૩) ફિલિપ્સ રેખા. (૪) લેણ-દેણની તુલાનો નાણાંકીય ખ્યાલ.

English Version

Que-1 Define consumption function. Discuss critically the psychological law of consumption given by Keynes. (14)
OR

Que-1 Discuss in detail Dusenberry's theory of consumption function. Differentiate it with Keynesian theory.

Que-2 Discuss main characteristics of IS-LM. Explain Governments monetary and fiscal policy measures with the help of IS-LM model and elaborate its effectiveness in detail. (14)

OR

Que-2 Discuss critically Liquid preference theory propounded by Keynes in detail.

Que-3 What is Inflation? Discuss Demand pull and Cost push inflation along with appropriate diagrams in detail. (14)

OR

Que-3 Explain the relationship between inflation and unemployment on the basis of rational expectation theorem in detail.

Que-4 Explain in detail the Mundell-Fleming model under fixed and flexible exchange rates. (14)

OR

Que-4 Discuss critically New Classical Economist's approach of Macroeconomics in detail.

Que-5 Write Short Notes. (Any Two) (14)

(1) Permanent Income Approach.

(2) Liquidity Trap.

(3) Philips Curve.

(4) Monetary approach to balance of payments.
